

Student Assistance for Coaching Class for IIM/CEPT/NIFT/NLU

➤ યોજનાનો હેતુ

- નિફ્ટ, સેપ્ટ, એનએલયુમાં પ્રવેશ મેળવવા માંગતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓએ ધોરણ.૧૦માં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધોરણ. ૧૨ (કોઈપણ પ્રવાહ)માં અભ્યાસ કરતા હોવા જોઈએ. જ્યારે આઈઆઈએમમાં પ્રવેશ મેળવવા માંગતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓએ ધોરણ.૧૨ (કોઈપણ પ્રવાહ)માં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને સ્નાતક કક્ષા (કોઈપણ પ્રવાહ)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય અથવા સ્નાતક પૂર્ણ કરેલ હોય તો સ્નાતકમાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેમને વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. યોજના શરૂ થયાનું વર્ષ : વર્ષ ૨૦૧૪-૧૫

➤ તાલીમાર્થીઓના નીચે મુજબના ધારાધોરણના આધારે કોચિંગ સહાય મળવા પાત્ર રહેશે.

- મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- તાલીમાર્થીએ CEPT, NIFT, NLUના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાની કોચિંગ સહાય માટે તાલીમાર્થીને ધોરણ-૧૦માં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.
- જ્યારે IIMના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાની કોચિંગ સહાય માટે વિદ્યાર્થીએ ધોરણ-૧૨ના કોઈ પણ પ્રવાહમાં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ અને કોઈ પણ પ્રવાહના સ્નાતક અભ્યાસક્રમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઈએ અથવા સ્નાતક થયેલ હોય તો સ્નાતકની પરીક્ષામાં ૬૦%થી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.
- IELTS, TOEFL, GRE જેવી વિદેશ અભ્યાસના હેતુસર આપવાની થતી પરીક્ષાની કોચિંગ સહાય માટે વિદ્યાર્થીએ ધોરણ-૧૨ના કોઈ પણ પ્રવાહમાં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.
- તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
- તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે.
- તાલીમાર્થીને આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
- તાલીમ આપનાર સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે.

➤ તાલીમાર્થીએ નીચે મુજબના ધારાધોરણ ધરાવતી સંસ્થા કોચિંગ સહાય માટે પસંદ કરવાની રહેશે.

- તાલીમાર્થીએ પસંદ કરેલ સંસ્થા GST/PAN નંબર ધરાવતી હોવી જોઈએ.
- તાલીમ આપતી સંસ્થા મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦, કંપની અધિનિયમ, ૧૯૫૬, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮) પૈકી કોઈપણ અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઈએ.
- સંસ્થા ઓછામાં ઓછું ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઈએ.
- સંસ્થા અન્ય સરકારી ધારાધોરણોનું પાલન કરતી હોવી જોઈએ.

➤ રજુ કરવાના ડોક્યુમેન્ટ

- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- એસ.એસ.સી./એચ.એસ.સી./સ્નાતક અભ્યાસક્રમની માર્કશીટ
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
- ફી ની પોંહચ (GST No. સહિત)

તાલીમ સંસ્થાએ આપવાનું થતું પ્રમાણપત્ર

સંસ્થાનું નામ:-

સરનામું-

GST NO:

CONTECT NO:

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે અમારી સંસ્થા..... નામે સરનામે ચાલતા IIM, NIFT, CEPT, NLU, IELTS, TOEFL અને GRE જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટેના તાલીમ વર્ગો ચાલે છે. અમારી સંસ્થા..... વર્ષનો અનુભવ ધરાવે છે. અત્રેના તાલીમ સ્થળ પર સી.સી.ટી.વી. કેમેરા, ફાયરસેફ્ટી અંગેનું એન.ઓ.સી. તેમજ વિદ્યાર્થીની હાજરી માટે બાયોમેટ્રીક મશીન પણ ઉપલબ્ધ છે તેમજ હાલમાં ઉપરોક્ત સરનામે કાર્યરત અવસ્થામાં છે. સરકારશ્રી દ્વારા જ્યારે પણ કોઈ માહિતી માંગવામાં આવશે તો તે અંગેની વિગત અમો મોકલી આપીશું. શ્રી રહે..... તા..... જી.....ને તા.....થી તા..... સમયગાળા માટે.....તાલીમ વર્ગમાં પ્રવેશ આપેલ છે.

તા.

સ્થળ

તાલીમ સંસ્થાના ચાર્ટડ એકાઉન્ટન્ટના સહી/સિક્કા

તાલીમ સંસ્થાના વડાના સહી/સિક્કા